

Ambuja Cement

ACL:SEC:

April 19, 2021

Bombay Stock Exchange Limited Phiroz Jeejeebhoy Towers, Dalal Street, Mumbai – 400 023 Scrip Code: 500425	National Stock Exchange of India Ltd., Plot No.C/1 'G' Block Bandra – Kurla Complex Bandra East, Mumbai 400 051 Scrip Code: AMBUJACEM
--	---

Dear Sir,


Sub.: Compliance Under Regulation 47(3) of SEBI (LODR) Regulations.2015

Pursuant to Regulation 47(3) of SEBI (LODR) Regulations, 2015, we herewith
enclose Newspaper copies of Board Meeting notice which was published on

16.04.2021

Kindly take the same on records.

Thanking you,
Yours faithfully,
For AMBUJA CEMENTS LIMITED



RAJIV GANDHI
COMPANY SECRETAR
Membership No A11263

Encl:- as above

Ambuja Cement

AMBUJA CEMENTS LIMITED

Regd. Office: P.O. Ambujanagar, Tal. Kodinar, Dist. Gir-Somnath, Gujarat 362715.
Corporate Office: Elegant Business Park, MIDC Cross Road "B",
Off Andheri-Kurla Road, Andheri (East), Mumbai. 400059.
CIN No: L26942GJ1981PLC004717 • Website: www.ambujacement.com
email: shares@ambujacement.com

NOTICE

Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of the Company will be held on Thursday, the 29th April, 2021 to consider, inter alia, the Unaudited quarterly financial results for first quarter ended 31st March 2021, of the financial year ending 31st December 2021.

This intimation is also available on the website of the company www.ambujacement.com and on the website of the Stock Exchanges where the shares of the Company are listed at www.bseindia.com and www.nseindia.com

For AMBUJA CEMENTS LTD

Place: Mumbai Sd/-
Date: 15th April, 2021 RAJIV GANDHI
COMPANY SECRETARY



Reliance
Industrial Infrastructure
Limited

Regd. Office: NKM International House, 5th Floor,
178 Backbay Reclamation, Behind LIC Yogakshema Building,
Babubhai Chinal Road, Mumbai - 400 020
Phone: 022-4477 9053 • Fax: 022-4477 9052
E-mail: investor_relations@riil.in
CIN: L60300MH1988PLC049019

Extract of Audited Consolidated Financial Results for the Year Ended 31st March, 2021

(₹ in Lakh, except per share data)

Particulars	Year ended	Year ended
	31st March, 2021	31st March, 2020
Total income from operations (net)	5,431.40	7,979.64
Net Profit from ordinary activities before tax	1,002.54	1,104.15
Net Profit from ordinary activities after tax	964.94	970.84
Total Comprehensive Income after tax	4,620.47	505.71
Equity Share Capital	1,510.00	1,510.00
Other Equity (reserves) excluding Revaluation reserves	39,685.62	35,518.15
Earnings Per Share (Face value of ₹ 10/- each) (for continuing operations)	6.39	6.43
Diluted	6.39	6.43

Note:

1. The Audit Committee reviewed the above results and the Board of Directors approved the above results and its release at their respective meetings held on 14th April, 2021.

Additional information on Audited Standalone Financial Results is as follows:

(₹ in Lakh)

Particulars	Year ended	Year ended
	31st March, 2021	31st March, 2020
Total income from operations (net)	5,431.40	7,979.64
Net Profit from ordinary activities before tax	807.69	926.01
Net Profit from ordinary activities after tax	770.09	792.70
Total Comprehensive Income after tax	4,425.62	327.57

2. The above is an extract of the detailed format of the Audited Standalone and Consolidated Financial Results for the year ended 31st March, 2021 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Standalone and Consolidated Financial Results for the year ended 31st March, 2021 are available on the Stock Exchange websites (www.bseindia.com / www.nseindia.com) and Company's website www.riil.in.

For Reliance Industrial Infrastructure Limited

Place: Mumbai Sd/-
Date: 14th April, 2021 Dilip V. Dherai
Executive Director

www.riil.in

FORM G

INVITATION FOR EXPRESSION OF INTEREST (Under Regulation 36A (1) of the Insolvency and Bankruptcy (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016)

RELEVANT PARTICULARS

1. Name of the Corporate Debtor	Topworth Steels & Power Pvt Ltd
2. Date of incorporation of Corporate Debtor	18 th May, 2004
3. Authority under which Corporate Debtor is incorporated / registered	Ministry of Corporate Affairs – ROC - Mumbai
4. Corporate Identity Number / Limited Liability Identification Number of Corporate Debtor	U51420MH2004PTC146381
5. Address of the Registered Office and Principal Office (if any) of Corporate Debtor	Registered & Corporate Office 308, 3rd Floor Ceejay House, Dr. A. B. Road, Worli Mumbai-400018 Plant Location Boral Industrial Growth Center, Vill. Rasmada, Durg Bypass, Durg-491001
6. Insolvency commencement date of the Corporate Debtor	January 29 th , 2020 (NCLT order received on 28 th February 2020)
7. Date of invitation of expression of interest	April 16 th , 2021
8. Eligibility for resolution applicants under section 25(2)(h) of the Insolvency and Bankruptcy Code, 2016 ("Code") is available at:	Details can be obtained at www.tsppil.co.in under CIRP Section and www.primusresolutions.in under Primus Public Announcements
9. Norms of ineligibility applicable under section 29A are available at:	Details can be obtained at www.tsppil.co.in under CIRP Section and www.primusresolutions.in under Primus Public Announcements
10. Last date for receipt of expression of interest	May 3 rd , 2021
11. Date of issue of provisional list of prospective Resolution Applicants	May 4 th , 2021
12. Last date for submission of objections to provisional list	May 8 th , 2021
13. Last date of issue of final list of prospective Resolution Applicants	May 10 th , 2021
14. Date of issue of information memorandum, evaluation matrix and request for resolution plans to prospective Resolution Applicants	May 8 th , 2021
15. Manner of obtaining request for resolution plan, evaluation matrix, information memorandum and further information	Request for resolution plan, evaluation matrix, information memorandum and further information shall be shared with applicants eligible as per provisions of Insolvency and Bankruptcy Code, 2016 and regulations made thereunder through email or any other electronic mode on execution of confidentiality undertaking
16. Last date for submission of resolution plans	June 7 th , 2021
17. Manner of submitting resolution plans to Resolution Professional	Details will be provided at the time of issue of Request for Resolution Plan
18. Estimated date for submission of resolution plans to the Adjudicating Authority for approval	June 30 th , 2021
19. Name and registration number of the Resolution Professional	Sanjay Gupta Reg. No.: IBB/IIPA-002/IP-N00982-C01/2017-2018/10354
20. Name, Address and e-mail of the Resolution Professional, as registered with the Board	Name: Sanjay Gupta Address registered with the Board: C-4-E135, Janakpuri, New Delhi - 110058 Email ID registered with the Board: sanjay@sgandia.in
21. Address and email to be used for correspondence with the Resolution Professional	Address for Correspondence: Primus Insolvency Resolution and Valuation Pvt. Ltd. 206A, Skyline Eptoma, Kiroi Road, Nr Jolly Gymkhana, Vidyavihar West, Mumbai - 400098 Email: tsppil@primusresolutions.in
22. Further Details are available at or with	This can be obtained by sending a request email at tsppil@primusresolutions.in or at +91-9540007506
23. Date of publication of Form G	April 16 th , 2021

The above 'timelines' are, inter alia, based on the exclusion due for COVID-19 pandemic granted by Hon'ble NCLT vide order dated March 25th, 2021.

Date: Friday, April 16, 2021
Place: New Delhi

Sd/-
Sanjay Gupta
Resolution Professional - Topworth Steels & Power Pvt Ltd
IP Registration No.: IBB/IIPA-002/IP-N00982-C01/2017-2018/10354

SURANA TELECOM AND POWER LIMITED
(CIN: L2320GTG1989PLC010336)
Regd Off: 5th Floor, Surya Towers, S.P. Road, Secunderabad-03

NOTICE is hereby given pursuant to SEBI Circular SEBI/RO/MHSD/DOS/3/CIR/P/2018/139 dated 6th November 2018 that, a request has been received by the Company relating to transfer of shares in physical mode as detailed below:

Name of transferor (Folio no)	Name of transferee	Share certificate no (Distinctive no)	No. of shares
Bhagwati Lal Jain (STL006143)	Vimal Prakash Jain	100328	2500
Deshbandhu P Gupta (STL008156)	Dhani Ram Sharma	100609	10000

Any person who has a claim/objection in respect of the abovementioned share transfers, should lodge their claim/objection with the Company at its Registered Office within 30 days from this date along with appropriate documentary evidence thereof in support of such claim, else the Company will proceed with the transfer of the above shares in respect of the transferee without any further intimation.

For SURANA TELECOM AND POWER LIMITED
Sd/-
Date: 15.04.2021
Place: Secunderabad
SRINIVAS DUDAM
COMPANY SECRETARY

KIRLOSKAR FERROUS INDUSTRIES LIMITED
A Kirloskar Group Company
Registered Office: 13, Laxmanrao Kirloskar Road, Khadki, Pune - 411 003, (Maharashtra)
CIN: L27101PN199PLC063223

Enriching Lives

NOTICE
Notice is hereby given that the meeting of the Board of Directors of the Company is scheduled to be held on Wednesday, 5 May 2021 to consider, inter-alia, the Audited Financial Results of the Company for the financial year ended 31 March 2021.

This intimation is also available at the website of the Company www.kirloskarferrous.com and that of the BSE Limited www.bseindia.com

For Kirloskar Ferrous Industries Limited
Sd/-
Date: 15 April 2021
Place: Pune
Mayuresh Garhpure
Company Secretary

Telephone: (020) 66084645 • Fax: (020) 25813208
E-mail: investor@kfil.com • Website: www.kirloskarferrous.com

Mark bearing word "Kirloskar" in any form as a suffix or prefix is owned by Kirloskar Proprietary Limited and "Kirloskar Ferrous Industries Limited" is the Permitted User.

FORM NO. INC-26
[Pursuant to Rule 30 of Companies (Incorporation) Rules 2014]
Advertisement to be published in Newspaper for the change in Registered Office of the Company from one state to another Before the Central Government Regional Director (Southern Region) In the matter of sub-section 4 of section 13 of the Companies Act 2013 and clause (a) of sub-section (5) of Rule 30 of the Companies (Incorporation) Rules 2014 AND In the matter of M/S L.J. INTERNATIONAL LIMITED (Corporate Identity Number: U01131TN1943PLC002723)

("The Company") A Company incorporated under the Companies Act, 1913 having its Registered Office at 60 Marshalls Road, Egmore, Chennai 600008 (No.60, Rukmani Lakshmi pathy Salai, Egmore, Chennai 600008) - The Petitioner Notice is hereby given to General Public that the company proposes to make the application to the Central Government (Powers delegated to Regional Director) under section 13 of the Companies Act 2013 read with Rule 30 of the Companies (Incorporation) Rules, 2014 seeking confirmation of alteration of Memorandum of Association of the company in terms of special resolution passed through Postal Ballot on Tuesday, 23rd Day of February, 2021 to enable the company to change its Registered Office from "State of Tamil Nadu" to "State of Kerala".

Any person whose interest is likely to be affected by the proposed change, may deliver either on MCA portal (www.mca.gov.in) by filling investor complaint form or cause to be delivered or sent by registered post of his/her objections supported by an affidavit stating the nature of his/her interest and grounds of opposition to the Regional Director at the Address 5th Floor, Shastri Bhawan, 26 Haddows Road, Chennai-600006, within 30 Days of date of publication of this notice with a copy to the applicant company at its registered office at the address mentioned below:

Registered Office: 60 Marshalls Road Egmore Chennai – 600 008 (No.60, Rukmani Lakshmi pathy Salai Egmore, Chennai 600008)

For and on behalf of L.J. INTERNATIONAL LIMITED
Place: Chennai DILIP THOMAS
Dated: 09-04-2021 DIN: 00052185

RattanIndia
RattanIndia Enterprises Limited
(formerly RattanIndia Infrastructure Limited)
(CIN: L74110DL2010PLC210263)
Registered Office: H.No. 9, First Floor, Vill. Hauz Khas, New Delhi 110016
Tel: 011-46611666, Fax: 011-46611777
Website: www.rattanindia.com, E-mail: ir@rattanindia.com

POSTAL BALLOT NOTICE

NOTICE is hereby given that RattanIndia Enterprises Limited ("the Company") has on April 15, 2021 completed the dispatch of Postal Ballot Notice dated April 12, 2021, to its members under Section 110 of the Companies Act, 2013, read with Rule 20 & 22 of the Companies (Management and Administration) Rules, 2014, for the purpose of seeking the consent of members of the Company, for the businesses set out in the said notice, to be transacted by postal ballot through remote e-voting.

In compliance with MCA Circular No. 14/2020 dated April 8, 2020, Circular No. 17/2020 dated April 13, 2020, Circular No. 22/2020 dated June 15, 2020, Circular No. 33/2020 dated September 28, 2020 and Circular No. 39/2020 dated December 31, 2020, issued by the Ministry of Corporate Affairs ("MCA circulars") and in conformity with the applicable regulatory requirements, the said Postal Ballot Notice has been sent only through electronic mode to those Members whose e-mail addresses are registered with their depository participants or with the Company's Registrar & Share Transfer Agent (RTA), as on April 09, 2021 (cut-off date).

In accordance with the provisions of the MCA circulars, physical copies of the Notice, postal ballot form and pre-paid business reply envelopes are not being sent to the Members for this postal ballot and Members entitled can vote only through remote e-voting.

Voting rights shall be reckoned on the paid-up capital of shares registered in the name of Members as on cut-off date. A person who is not a Member of the Company as on cut-off date should treat the Notice for information purpose only.

In case a member desires to exercise vote by using remote e-voting as stipulated under Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing remote e-voting platform for the above through KFin Technologies Private Limited ("KFINTECH"). The procedure for remote e-voting are provided in the Notice and also available on the website of RTA under remote e-voting section at: <https://evoting.kfintech.com>.

Notice is further given that the remote e-voting will commence on Friday, 16 April, 2021 at 09:00 A.M. onwards and will continue till 5:00 P.M. on Saturday, 15 May, 2021. The remote e-voting shall not be allowed beyond 5:00 P.M. on Saturday, 15 May, 2021.

The cut-off date for the purpose of remote e-voting has been fixed as Friday, April 09, 2021. A person whose name is recorded in the register of members or register of beneficial owners maintained by depositories as on cut-off date shall be entitled to avail the facility of remote e-voting.

Members holding shares in physical form or those who have not registered their e-mail ID with Company or RTA can cast their vote through remote e-voting by registering their e-mail ID and applying to the Company or Kfintech. Detailed instructions are provided in the Notice. Those shareholders whose e-mail ID is not registered, can register their e-mail ID with Kfintech or RTA by sending e-mail at evoting@kfintech.com by providing their name registered as per the records of the Company, address, e-mail ID, PAN, DP ID/Client ID or Folio Number and number of shares held by them.

Postal Ballot Notice along with Explanatory Statement including remote e-voting instructions can be downloaded from the Company's website: www.rattanindia.com or from the stock exchanges website i.e. www.bseindia.com or www.nseindia.com or may apply to the Company or RTA and obtain duplicate thereof.

The Results shall be declared along with the Scrutinizers' Report not later than 48 hours of the conclusion of the remote e-voting i.e. Monday, May 17, 2021 at the Registered Office of the Company and shall also be placed on the Company's website www.rattanindia.com and on the website of KFINTECH i.e. <https://evoting.kfintech.com> and shall be communicated to the Stock Exchanges where the Company's shares are listed.

In case of any queries / grievances connected with remote e-voting, you may refer to the Frequently Asked Questions (FAQs) for Shareholders and remote e-voting user manual for Shareholders available at the Downloads sections of <https://evoting.kfintech.com> or Ms. C Shobha Anand at KFin Technologies Private Limited, (Unit : RattanIndia Enterprises Limited), Selenium Tower B, Plot No. 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad – 500 032, Toll Free No. 1800-3454-001.

For RattanIndia Enterprises Limited
Sd/-
R. K. Agarwal
Company Secretary

Place: New Delhi
Date: April 15, 2021



Extract of audited financial results of Wipro Limited and its subsidiaries for the quarter ended March 31, 2021

Consolidated Audited Financial Results of Wipro Limited under IFRS

(₹ in millions, except per share data, unless otherwise stated)

Particulars	Quarter ended March 31, 2021	Year ended March 31, 2021	Quarter ended March 31, 2020
Total income from operations (net)	163,340	622,344	158,498
Net Profit / (Loss) before tax and exceptional items	37,496	139,007	29,656
Net Profit / (Loss) before tax but after exceptional items	37,496	139,007	29,656
Net Profit / (Loss) after tax and exceptional items	29,741	108,662	23,451
Total Comprehensive Income after tax	29,125	115,341	25,175
Equity Share Capital	10,958	10,958	11,427
Reserves (excluding Revaluation Reserve) ¹ as shown in the Audited Statement of Financial Position	542,137	542,137	546,031
Earnings Per Share (of ₹2/- each)			
Basic:	5.39	19.11	4.09
Diluted:	5.38	19.07	4.07

¹ Balance for the quarter and year ended March 31, 2021 represent balances as per the audited Statement of Financial Position for the year ended March 31, 2021 and balance for the quarter ended March 31, 2020 represent balances as per the audited Statement of Financial Position for the year ended March 31, 2020, as required by the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

The audited interim consolidated financial results of the Company for the quarter and year ended March 31, 2021 have been approved by the Board of Directors of the Company at its meeting held on April 15, 2021. The statutory auditors have expressed an unmodified audit opinion.

Financial Results of Wipro Limited under Ind AS

The interim condensed financial results are prepared in accordance with Indian Accounting Standards ("Ind AS"), the provisions of the Companies Act, 2013 ("the Companies Act"), as applicable and guidelines issued by the Securities and Exchange Board of India ("SEBI"). The Ind AS are prescribed under Section 133 of the Act read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 and amendment rules issued thereafter.

Consolidated Audited Financial Results of Wipro Limited under Ind AS

Particulars	Quarter ended March 31, 2021	Year ended March 31, 2021	Quarter ended March 31, 2020
Total income from operations (net)	162,454	619,349	157,505
Net Profit / (Loss) before tax and exceptional items	37,499	139,029	29,658
Net Profit / (Loss) before tax but after exceptional items	37,499	139,029	29,658
Net Profit / (Loss) after tax and exceptional items	29,743	108,680	23,452
Total Comprehensive Income after tax	29,120	115,497	24,944
Equity Share Capital	10,958	10,958	11,427
Reserves (excluding Revaluation Reserve) ¹ as shown in the Audited Balance Sheet	538,052	538,052	541,790
Earnings Per Share (of ₹2/- each)			
Basic:	5.39	19.11	4.09
Diluted:	5.38	19.07	4.08

¹ Balance for the quarter and year ended March 31, 2021 represent balances as per the audited Statement of Financial Position for the year ended March 31, 2021 and balance for the quarter ended March 31, 2020 represent balances as per the audited Balance sheet for the year ended March 31, 2020, as required by the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

The audited interim consolidated financial results (under Ind AS) of the Company for the quarter and year ended March 31, 2021 have been approved by the Board of Directors of the Company at its meeting held on April 15, 2021. The statutory auditors have expressed an unmodified audit opinion.

Standalone Audited Financial Results of Wipro Limited under Ind AS

Particulars	Quarter ended March 31, 2021	Year ended March 31, 2021	Quarter ended March 31, 2020
Total income from operations (net)	132,600	502,994	131,272
Net Profit / (Loss) before tax and exceptional items	36,814	126,848	27,627
Net Profit / (Loss) before tax but after exceptional items	36,814	126,848	27,627
Net Profit / (Loss) after tax and exceptional items	30,130	100,609	21,583
Total Comprehensive Income after tax	30,353	106,946	18,865

The audited interim standalone financial results (under Ind AS) of the Company for the quarter and year ended March 31, 2021 have been approved by the Board of Directors of the Company at its meeting held on April 15, 2021. The statutory auditors have expressed an unmodified audit opinion.

Notes:

1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Bombay Stock Exchange website (URL: www.bseindia.com), the National Stock Exchange website (URL: www.nseindia.com) and on the Company's website (URL: www.wipro.com).

By Order of the Board,
For Wipro Ltd.

Place: Bengaluru
Date: April 15, 2021

Rishad A Premji
Chairman

Registered Office: Wipro Limited, Doddakannelli, Sarjapur Road, Bengaluru-560035, India
Website: wipro.com | Email Id: info@wipro.com | Tel: +91-80-2844 0011; Fax: +91-80-2844 0054
CIN: L32102KA1945PLC020800

Ambuja Cement
અંબુજા સિમેન્ટ લીમીટેડ

રજીસ્ટર્ડ ઓફિસ: પી.ઓ. અંબુજાનગર, તાલુકો: શ્રેણીનાર, જિલ્લો: નીર સોમનાથ, ગુજરાત - ૩૬૨ ૩૧૫
ફોર્ટિફિકેશન: એસીઆર (બિએસ પાર્ક, અમદાવાદ) એસ વી. બી.
અંબેડી ક્રમ વે. અંબેડી (પ્રમ્), મુંબઈ - ૪૦૦ ૦૫૮.
CIN: L26942GJ1981PLC004717 - વેબસાઇટ : www.ambujacement.com
ફોન: shares@ambujacement.com

નોટીસ

આથી સેબી (લિસ્ટિંગ ઓફિસેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિજલેશન્સ) રેગ્યુલેશન્સ ૨૦૧૫ ના નિયમ ૪૭ ના નિયમ ૨૮ સાથે વાંચન લેકન નોટીસ આપવામાં આવે છે કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મેટિંગ ગુસ્તાર, ૨૮ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ અચ બાબતો સાથે ૩૧ માર્ચ, ૨૦૨૧ ના રોજ પુરા થતાં પ્રથમ ત્રિમાસિક ગણા, ૩૧ માર્ચ, ૨૦૨૧ ના રોજ પુરા થતાં ત્રિમાસિક વર્ષના અનઓલિટેડ નાણાકિય પરિણામોની વિચારણા માટે યોજાશે.

આ માહિતી કંપનીની વેબસાઇટ www.ambujacement.com અને જ્યાં કંપનીના શેર હિસ્ટેડ થયેલા છે તે શેરબજારોની વેબસાઇટ www.bseindia.com અને www.nseindia.com ઉપર પ્રાપ્ય છે.

અંબુજા સિમેન્ટ લીમીટેડ તરીકે સહી/સહીવતી સહી/સહીવતી તારીખ: ૧૫ એપ્રિલ, ૨૦૨૧

Bank of India
Head Office: Star House 1, Risk Management Department, Information Security Cell, 3rd Floor, East Wing, C-5-G Block, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai 400 051. Email: securityinformation@bankofindia.co.in

TENDER NOTICE

Bank of India invites Request for Quote (RFQ) for Cyber Insurance. Last date for submission of Request for Quote: **05.05.2021 by 4.00 pm**. Full details are available on the Bank's Corporate Website: www.bankofindia.co.in under "Tender" Section from 15.04.2021. Amendments / Corrigendum, if any, will be kept on website only.

SBI
State Bank of India
"Synergy", 5th Floor, C-6, G Block, Bandra - Kurla Complex, Bandra (E), Mumbai - 400051.

EMPANELMENT OF SERVICE PROVIDER FOR SCANNING & DIGITISATION OF BANK DOCUMENTS

Applications are invited from interested parties for empanelment as Outsourcing Agents for Scanning and Digitisation of Bank documents for Maharashtra. For details, please log on to: bank.sbi/SBI.in/news>procurementnews. The last date for submission of application is 14th May 2021.

Place: Mumbai Deputy General Manager (REHBU)
Date: 16.04.2021

Reliance
Industrial Infrastructure Limited

Regd. Office: NKM International House, 5th Floor, 178 Backbay Reclamation, Behind LIC Yagaksheema Building, Babubhai Chinai Road, Mumbai - 400 020
Phone: 022-4477 9053 • Fax: 022-4477 9052
E-mail: investor_relations@riil.in
CIN: L60300MH1988PLC049019

Extract of Audited Consolidated Financial Results for the Year Ended 31st March, 2021

(₹ in Lakh, except per share data)

Particulars	Year ended 31st March, 2021	Year ended 31st March, 2020
Total income from operations (net)	5,431.40	7,979.64
Net Profit from ordinary activities before tax	1,002.54	1,104.15
Net Profit from ordinary activities after tax	964.94	970.84
Total Comprehensive Income after tax	4,620.47	505.71
Equity Share Capital	1,510.00	1,510.00
Other Equity (reserves) excluding Revaluation reserves	39,685.62	35,518.15
Earnings Per Share (Face value of ₹ 10/- each) (for continuing operations)	6.39	6.43
Basic	6.39	6.43
Diluted	6.39	6.43

Note:
1. The Audit Committee reviewed the above results and the Board of Directors approved the above results and its release at their respective meetings held on 14th April, 2021.
Additional Information on Audited Standalone Financial Results is as follows:

(₹ in Lakh)

Particulars	Year ended 31st March, 2021	Year ended 31st March, 2020
Total income from operations (net)	5,431.40	7,979.64
Net Profit from ordinary activities before tax	807.69	926.01
Net Profit from ordinary activities after tax	770.09	792.70
Total Comprehensive Income after tax	4,425.62	327.57

2. The above is an extract of the detailed format of the Audited Standalone and Consolidated Financial Results for the year ended 31st March, 2021 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Standalone and Consolidated Financial Results for the year ended 31st March, 2021 are available on the Stock Exchange websites (www.bseindia.com / www.nseindia.com) and Company's website www.riil.in.

For Reliance Industrial Infrastructure Limited
Sd/-
Dilip V. Dherai
Executive Director
Place: Mumbai
Date: 14th April, 2021
www.riil.in

(THIS IS ONLY AN ADVERTISEMENT FOR INFORMATION PURPOSE AND NOT A PROSPECTUS ANNOUNCEMENT AND DOES NOT CONSTITUTE AN INVITATION OR OFFER TO ACQUIRE, PURCHASE OR SUBSCRIBE FOR SECURITIES. NOT FOR DISTRIBUTION AND PUBLICATION, DIRECTLY OR INDIRECTLY OUTSIDE INDIA)

KUBERAN GLOBAL EDU SOLUTIONS LIMITED

Our Company was originally incorporated as "Kuberan Global Edu Solutions Limited" as Public Limited Company under the provisions of Companies Act, 1956 vide Certificate of Incorporation dated May 22, 2013 bearing Corporate Identity Number is U80900TZ2013PLC019519 issued by Registrar of Companies, Tamil Nadu, Coimbatore. For further details, pertaining to the change in Registered Office of our Company, please refer to the section titled "Our History and Corporate Structure" beginning on page 132 of the Prospectus.

Registered office and Corporate Office: 401, GES Complex, 1st Floor, 7th Street, Gandhipuram, Coimbatore, Tamil Nadu – 641012, India | Tel No: 04224348001 | Email: investor@kgesltd.in | Website: www.kgesltd.in | Contact Person: Aditya Tripathi, Company Secretary and Compliance Officer

PROMOTER OF THE COMPANY: CHANDRAMOULEESWARAN KRISHNAN

PUBLIC ISSUE OF 5,58,000* EQUITY SHARES OF FACE VALUE OF RS. 10/- EACH OF KUBERAN GLOBAL EDU SOLUTIONS LIMITED ("KGESL" OR THE "COMPANY" OR THE "ISSUER") FOR CASH AT A PRICE OF RS. 20/- PER EQUITY SHARE INCLUDING A SHARE PREMIUM OF RS. 10/- PER EQUITY SHARE (THE "ISSUE PRICE") AGGREGATING TO RS. 111.60 LAKHS ("THE ISSUE"), OF WHICH 30,000 EQUITY SHARES OF FACE VALUE OF RS. 10/- FOR CASH AT A PRICE OF RS. 20/- PER EQUITY SHARE INCLUDING A SHARE PREMIUM OF RS. 10/- PER EQUITY SHARE AGGREGATING TO RS. 6.00 LAKHS WILL BE RESERVED FOR SUBSCRIPTION BY MARKET MAKER TO THE ISSUE (THE "MARKET MAKER RESERVATION PORTION"). THE ISSUE LESS THE MARKET MAKER RESERVATION PORTION I.E. NET ISSUE OF 5,28,000 EQUITY SHARES OF FACE VALUE OF RS. 10/- EACH AT A PRICE OF RS 20/- PER EQUITY SHARE AGGREGATING TO RS. 105.60 LAKHS IS HEREAFTER REFERRED TO AS THE "NET ISSUE". THE ISSUE AND THE NET ISSUE WILL CONSTITUTE 26.49% AND 25.06%, RESPECTIVELY OF THE POST ISSUE PAID UP EQUITY SHARE CAPITAL OF OUR COMPANY.

*Our Company had undertaken a Pre-IPO Placement of 40,000 Equity shares for cash at a price of Rs. 20/- per Equity share aggregating to Rs. 8.00 Lakhs pursuant to the Board Resolution dated August 09, 2020. The fresh issue of up to 6,00,000 Equity shares has been reduced by 40,000 Equity shares pursuant to Pre-IPO Placement and accordingly the fresh issue is 5,58,000 Equity shares, subject to a minimum issue size of 25% of the post issue paid up equity share capital being issued to the public. The Equity Shares allotted under the Pre-IPO Placement, is subject to a lock-in period of one (1) year from the date of Allotment pursuant to the Issue.

THE FACE VALUE OF THE EQUITY SHARE IS RS 10/- EACH AND THE ISSUE PRICE OF RS 20/- THE ISSUE PRICE IS 2.00 TIMES OF THE FACE VALUE OF THE EQUITY SHARE.

THIS ISSUE IS BEING MADE IN TERMS OF CHAPTER IX OF THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (ISSUE OF CAPITAL AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS, 2018 ("SEBI ICDR") READ WITH RULE 19(2)(b)(i) OF THE SECURITIES CONTRACTS (REGULATION) RULES, 1957, AS AMENDED. THIS ISSUE IS A FIXED ISSUE AND ALLOCATION IN THE NET OFFER TO THE PUBLIC WILL BE MADE IN TERMS OF REGULATIONS 253(2) OF THE SEBI ICDR REGULATIONS 2018. FOR FURTHER DETAILS, PLEASE REFER TO SECTION TITLED "TERMS OF THE ISSUE" BEGINNING ON PAGE NO 219 OF THE PROSPECTUS. A COPY OF THE PROSPECTUS HAS BEEN DELIVERED FOR REGISTRATION TO THE REGISTRAR OF COMPANIES, COIMBATORE, TAMIL NADU AS REQUIRED UNDER SECTION 26 OF THE COMPANIES ACT, 2013.

FIXED PRICE ISSUE AT RS 20/- PER EQUITY SHARE MINIMUM APPLICATION OF 6000 EQUITY SHARES AND IN MULTIPLES OF 6000 EQUITY SHARES THEREAFTER

ISSUE OPENS ON : APRIL 20, 2021 CLOSURES ON : APRIL 27, 2021

ASBA
Simple, Safe, Smart way of Application- Make use of it !!!
*Applications Supported by Blocked Amount (ASBA) is a better way of applying to issues by simply blocking the fund in the bank account, investors can avail the same. For details, check section on ASBA below.
Mandatory in public issue No cheque / demand draft will be accepted

UPI - Now Mandatory in ASBA for Retail Individual Investors (RII) applying through Registered Brokers, DPs and RTAs. RII also have option to submit the application directly to the ASBA Bank (SCSBs) or to use the facility of linked online trading, demat and bank account. Investors are required to ensure that the Bank A/C used for bidding is linked to their PAN

For details on ASBA and UPI process, please refer to the details given in Application Form, Abridged Prospectus and General Information Document for investing in the public issue and also please refer to Section "Issue Procedure" beginning on page 225 of the Prospectus. ASBA Forms can be downloaded from the websites of BSE Limited ("BSE") and can be obtained from the list of banks that is displayed on the website of the Securities and Exchange Board of India ("SEBI") at www.sebi.gov.in. List of banks supporting UPI is also available on the website of SEBI at www.sebi.gov.in. For the list of UPI Apps and Banks live on IPO, please refer to the link: www.sebi.gov.in.

FORM G
INVITATION FOR EXPRESSION OF INTEREST
(Under Regulation 36A (1) of the Insolvency and Bankruptcy (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016)

RELEVANT PARTICULARS

1. Name of the Corporate Debtor	Topworth Steels & Power Pvt Ltd
2. Date of incorporation of Corporate Debtor	18 th May, 2004
3. Authority under which Corporate Debtor is incorporated/registered	Ministry of Corporate Affairs – ROC - Mumbai
4. Corporate Identity Number / Limited Liability Identification Number of Corporate Debtor	U51420MH2004PTC146381
5. Address of the Registered Office and Principal Office (if any) of Corporate Debtor	Registered & Corporate Office 308, 3rd Floor Cejaj House, Dr. A. B. Road, Worli Mumbai- 400018 Plant Location Boral Industrial Growth Center, VIII, Rasmada, Durg Bypass, Durg-491001
6. Insolvency commencement date of the Corporate Debtor	January 29 th , 2020 (NCLT order received on 28 th , February 2020)
7. Date of invitation of expression of interest	April 16 th , 2021
8. Eligibility for resolution applicants under section 25(2)(h) of the Insolvency and Bankruptcy Code, 2016 ("Code") is available at:	Details can be obtained at www.tsppi.co.in under CIRP Section and www.primusresolutions.in under Primus Public Announcements
9. Norms of ineligibility applicable under section 29A are available at:	Details can be obtained at www.tsppi.co.in under CIRP Section and www.primusresolutions.in under Primus Public Announcements
10. Last date for receipt of expression of interest	May 3 rd , 2021
11. Date of issue of provisional list of prospective Resolution Applicants	May 4 th , 2021
12. Last date for submission of objections to provisional list	May 8 th , 2021
13. Date of issue of final list of prospective Resolution Applicants	May 10 th , 2021
14. Date of issue of information memorandum, evaluation matrix and request for resolution plans to prospective Resolution Applicants	May 8 th , 2021
15. Manner of obtaining request for resolution plan, evaluation matrix, information memorandum and further information	Request for resolution plan, evaluation matrix, information memorandum and further information shall be shared with applicants eligible as per provisions of Insolvency and Bankruptcy Code, 2016 and regulations made thereunder through email or any other electronic mode on execution of confidentiality undertaking
16. Last date for submission of resolution plans	June 7 th , 2021
17. Manner of submitting resolution plans to Resolution Professional	Details will be provided at the time of issue of Request for Resolution Plan
18. Estimated date for submission of resolution plan to the Adjudicating Authority for approval	June 30 th , 2021
19. Name and registration number of the Resolution Professional	Sanjay Gupta Reg. No.: IBBI/IPA-002/IP-N00982-C01/2017-2018/10354
20. Name, Address and e-mail of the Resolution Professional, as registered with the Board	Name: Sanjay Gupta Address registered with the Board: C-4-E/135, Janakpuri, New Delhi - 110058 Email ID registered with the Board: sanjay@sgaia.in
21. Address and email to be used for correspondence with the Resolution Professional	Address for Correspondence: Primus Insolvency Resolution and Valuation Pvt. Ltd. 206A, Skyline Epitome, Kirod Road, Nr Jolly Gymkhana, Vidyanagar West, Mumbai - 400086 Email: tsppi@primusresolutions.in
22. Further Details are available at or with	This can be obtained by sending a request email at tsppi@primusresolutions.in or at +91-9540007506
23. Date of publication of Form G	April 16 th , 2021

The above timelines are, inter alia, based on the exclusion due for COVID-19 pandemic granted by Hon'ble NCLT vide order dated March 25th, 2021.

Sd/-
Sanjay Gupta
Resolution Professional - Topworth Steels & Power Pvt Ltd
Date: Friday, April 16, 2021
Place: New Delhi
IP Registration No.: IBBI/IPA-002/IP-N00982-C01/2017-2018/10354

ADDENDUM CUM CORRIGENDUM - NOTICE TO INVESTORS

This Addendum-cum-Corrigendum ("Addendum-cum-Corrigendum") is with reference to the Prospectus dated March 25, 2021 filed in relation to the Issue. In this regard, please note the following:
Pursuant to the circular dated March 31, 2021 issued by SEBI in relation to reduction in period for unblocking/refund of application money, please note the following:
(i) Under the heading "We Confirm that" on page 210 of the Prospectus, the point b. the statement "If such money is not repaid within eight (8) days from the date our Company becomes liable to repay it, then our Company and every officer in default shall, on and from expiry of eight (8) days, be liable to repay such application money with interest as prescribed under Section 40 of the Companies Act and SEBI ICDR Regulations." shall be read as, "If such money is not repaid within four (4) days from the date our Company becomes liable to repay it, then our Company and every officer in default shall, on and from expiry of four (4) days, be liable to repay such application money with interest as prescribed under Section 40 of the Companies Act and SEBI ICDR Regulations."
(ii) Under the heading "LISTING" that on page 213 of the Prospectus, the statement, "The Allotment Advice shall be issued or application money shall be refunded / unblocked within fifteen (15) days from the closure of the Issue", shall be read as, "The Allotment Advice shall be issued or application money shall be refunded / unblocked within four (4) days from the closure of the Issue".
(iii) Under the heading Grounds for refund please refer to point "Non-Receipt of Listing Permission" on page 253 of the Prospectus, the statement, "If such money is not repaid within eight days after the Issuer becomes liable to repay it, then the Issuer and every director of the Issuer who is an officer in default may, on and from such expiry of eight days, be liable to repay the money, with interest at such rate" shall be read as, "If such money is not repaid within four days after the Issuer becomes liable to repay it, then the Issuer and every director of the Issuer who is an officer in default may, on and from such expiry of four days, be liable to repay the money, with interest at such rate".
(iv) Under the heading "Minimum Subscription" on page 253-254 of the Prospectus, the statement, "If there is a delay beyond eight days after the Issuer become liable to pay the amount", shall be read as, "if there is a delay beyond four days, after the issuer become liable to pay the amount".
(v) Under the statement the heading "INTEREST IN CASE OF DELAY IN ALLOTMENT OR REFUND TO SCSBS BY RTA" on page 255 of the Prospectus "the refund instructions have not been given to the clearing system in the disclosed manner within eight days from the date of the closure of the issue", shall be read as, "the refund instructions have not been given to the clearing system in the disclosed manner within four days from the date of the closure of the issue".
All capitalized terms used in this Addendum-cum-Corrigendum shall, unless the context otherwise requires, have the meaning ascribed in the Prospectus. The Prospectus shall be read in conjunction with this Addendum-cum-Corrigendum. The relevant changes shall be reflected in the Prospectus stand amended to the extent stated herein above.

Kuberan Global Edu Solutions Limited
On behalf of the Board of Directors
Sd/-
Chandramouleeswaran Krishnan
Managing Director

Date: April 15, 2021
Place: Coimbatore

Kuberan Global Edu Solutions Limited is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an Initial Public Issue of its Equity Shares and has filed the Prospectus with the Registrar of Companies, Coimbatore, Tamil Nadu. The Prospectus is available on the website of SEBI at www.sebi.gov.in, the website of the Lead Manager at www.fedsec.in, website of the BSE Limited at www.bseindia.com and website of Issuer Company at www.kgestltd.in.
Potential Investors should note that investment in Equity Shares involves a high degree of risk. For details, investors should refer to and rely on the Prospectus including the section titled "Risk Factors" beginning on page no. 28 of the Prospectus. The Equity Shares have not been and will not be registered under the US Securities Act (the "Securities Act") or any state securities law in United States and will not be issued or sold within the United States or to, or for the account or benefit of "U.S. persons" (as defined in the Regulation S under the Securities Act), except pursuant to an exemption from, or in a transaction not subject to the registration requirements of the Securities Act of 1933.

IRCON OFS oversubscribed on Day 1

PRESS TRUST OF INDIA
New Delhi, March 3

THE OFFER FOR sale (OFS) of IRCON was oversubscribed on the first day of issue by institutional investors.

The government is selling up to 16% stake at a floor price of ₹88 a share in railway PSU IRCON. The issue will open for retail investors on Thursday.

The base issue size of the OFS is 10% or over 4.70 crore equity shares, with a greenshoe option to retain over-subscription of 6% or over 2.82 crore shares. The total issue size, including a greenshoe option, comes to 16% or over 7.52 crore shares.

"Offer for sale of govt shares in IRCON got a great response on day one. Issue subscribed 3.3 times of base size at a clearing price above the floor price by non-retail investors," Department of Investment and Public Asset Management (DIPAM) secretary Tuhin Kanta Pandey

tweeted.

He said the government has decided to exercise the greenshoe option.

The government holds an 89.18% stake in IRCON, which is under the railways ministry

and into the construction of transportation infrastructure. Shares of IRCON closed at ₹91.10, down 6.90% over the previous close.

The government has set a disinvestment target of

₹32,000 crore in the revised estimates for the current financial year.

So far, it has realised ₹20,626 crore through minority stake sale in CPSEs and share buybacks.



Motilal Oswal Asset Management Company Limited
Registered & Corporate Office: 10th Floor, Motilal Oswal Tower, Rahimtullah Sayani Road, Opposite Parel ST Depot, Prabhadevi, Mumbai - 400 025
• Toll Free No.: +91 8108622222, +91 22 40548002 • Email: mfservice@motilalosal.com
• CIN No.: U67120MH2008PLC188186
• Website: www.motilalosalwalf.com and www.mostshares.com

Notice cum Addendum to the Scheme Information Document (SID) and Key Information Memorandum (KIM) of the Scheme(s) of Motilal Oswal Mutual Fund (MOMF)

Investors are requested to take note of the following addition in the Investor Service Centre of Kfin Technologies Private Limited, the Registrar and Transfer Agent to the Schemes of MOMF w.e.f. March 03, 2021.

This notice cum addendum forms an integral part of SID and KIM of the Scheme(s) of MOMF. All other contents remain unchanged.

For Motilal Oswal Asset Management Company Limited
(Investment Manager for Motilal Oswal Mutual Fund)

Sd/-
Navin Agarwal
Managing Director & Chief Executive Officer

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

Place: Mumbai Date: March 03, 2021

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

Ambuja Cement

AMBUJA CEMENTS LIMITED

Regd. Office: P. O. Ambujanagar, Tal. Kodinar, Dist. Gir Somnath, Gujarat 362715.
Corporate Office: Elegant Business Park, MIDC Cross Road "B", Off Andheri-Kurla Road, Andheri (East), Mumbai - 400059.
CIN No. L26942GJ1981PLC004717 | Website: www.ambujacement.com

NOTICE

Notice is hereby given that the Company pursuant to the request from the following shareholders has proposed to issue duplicate share certificates in lieu of the original share certificates of Rs.2/- each, which have been reported to be lost / misplaced as per the details given hereunder:

Folio No(s).	Name of the Shareholder(s)	Certificate No(s).	Distinctive No(s).		Shares
			From	To	
S13097	SUKALI LASKAR	18392	22100286	22102285	2000
			911717023	911718022	1000
A10002	ASIS LASKAR	900	911681	913680	2000
			901123162	901124161	1000
B20351	BISHNU KUMAR KEDIA	2865	2825411	2825970	560
			902079974	902080253	280
0128986	RAVINDER JAIN	96518	1515252760	1515252799	40
34045809	RAVINDER NATH BHATIA	25808	966292484	966294115	1632
10199672	RAVINDER NATH BHATIA	25768	940359140	940360139	1000
0114138	NIKHAR BHATIA	89750	1514963379	1514963438	60
			8739516	8742695	3180
H08329	HANSRAJ BHUJRAJ KATHURIA	7235	905036926	905038515	1590
			26631996	26635185	3190
NP3241	POONAM JADHWANI	23577	913982731	913984325	1595
E05370	EDNAMOREEN D'SOUZA	24350	29720006	29730005	10000
			915526691	915531690	5000

Any person having claim or objection to the above must inform to the company within 15 days from the date of this Notice

For Ambuja Cements Ltd
Sd/-
(Rajiv Gandhi)
Company Secretary

Place: Mumbai Date: 03rd March 2021

Before the National Company Law Tribunal
Jaipur Bench, Jaipur
CA(CAA) No.72 / 230 / JPR / 2020
Read with
IA No. 427/JPR/2020
In
CA(CAA) No.72 / 230 / JPR / 2020
In the Matter of the Companies Act, 2013 - Section 230(1) read with Section 232(1)

And
In the Matter of:
Mangalam Cement Limited, a Company incorporated under the provisions of the Companies Act, 1956 and being a Company within the meaning of the Companies Act, 2013, having Corporate Identification No. L26943RJ1976PLC001705 and its registered office at P.O.: Aditya Nagar - 326520, Morak, District: Kota, in the State of Rajasthan. Applicant

DECLARATION OF RESULTS OF MEETINGS

A. The resolution for approval of the Scheme of Amalgamation of Mangalam Timber Products Limited (Transferee Company) with Mangalam Cement Limited (Transferee Company) was approved by requisite majority at the meeting of the equity shareholders conducted through postal ballot, remote e-voting and e-voting at the meeting held on 1st March, 2021 at 10:00 A.M (IST) through video conferencing/other audio visual means ("VC/OAVM") and unanimously at the respective meetings of secured and unsecured creditors of the said Transferee company conducted through remote e-voting and e-voting at the meeting held on 1st March, 2021 at 12:00 NOON (IST) and 2.30 P.M. (IST) respectively through VC/OAVM in terms of the order dated 12th March, 2020 in CA (CAA) No. 72/ 230 / JPR / 2020 modified by order dated 7th January 2021 in I.A. No. 427/JPR/2020 of the Hon'ble National Company Law Tribunal, Jaipur Bench ("NCLT") in the following manner:

Sl.	Particulars	For		Against		
		No. of Persons	No. of Votes	No. of Persons	No. of Votes	
1	Equity Shareholders (Promoter and Promoter Group)	(a) By Postal Ballot	1	85000	-	-
		(b) By Remote e-voting	8	6307820	-	-
		(c) By E-voting during the meeting	-	-	-	-
		Total	9	6392820	-	-
2	Equity Shareholders (Public Shareholders)	(a) By Postal Ballot	2	200600	-	-
		(b) By Remote e-voting	99	5503086	5	777284
		(c) By E-voting during the meeting	4	834141	-	-
		Total	105	6537827	5	777284
Total (1) + (2)		114	12930647	5	777284	
3	Secured Creditors	(a) By Remote e-voting	8	6127458574	-	-
		(b) By E-voting during the meeting	-	-	-	-
		Total	8	6127458574	-	-
4	Unsecured Creditors	(a) By Remote e-voting	1551	1036352229	-	-
		(b) By E-voting during the meeting	-	-	-	-
		Total	1551	1036352229	-	-

B. It is clarified that in terms of the said orders of the Hon'ble NCLT (a) no other meetings were directed to be held; and (b) option for casting votes by postal ballot/ remote e-voting / e-voting during the virtual meeting held on 1st March, 2021 at 10:00 A.M. was given only to the equity shareholders. Secured and Unsecured Creditors were given the option of voting by remote e-voting and e-voting during the virtual meeting held on 1st March, 2021 at 12:00 NOON (IST) and 2.30 P.M. (IST) respectively. No votes were declared invalid in any of the respective meetings of the Equity Shareholders, Secured Creditors and/or the Unsecured Creditors of the Company. Results of the meetings of the Equity Shareholders, Secured and Unsecured Creditors of the Company was declared on 2nd March, 2021 and was uploaded simultaneously on the website of the Company i.e. www.mangalamcement.com

C. Accordingly, I declare that the resolution for approval of the Scheme was adopted by the requisite majority of the equity shareholders and unanimously by the secured and unsecured creditors, as aforesaid.

Sd/-
Pradeep Pincha
Chairperson appointed for the meetings of Equity Shareholders, Secured Creditors and Unsecured Creditors of the Company vide order dated 12th March, 2020 in CA (CAA) No. 72/ 230 / JPR / 2020 modified by order dated 7th January 2021 in I.A. No. 427/JPR/2020 of the Hon'ble National Company Law Tribunal, Jaipur

Dated this 03rd day of March, 2021

MANGALAM CEMENT LIMITED
Regd. Office: P.O. Adityanagar 326520, Morak, Dist. Kota (Rajasthan) | CIN: L26943RJ1976PLC001705
Phone: +91 7459 233 127 | Fax: +91 7459 232 036
Website: www.mangalamcement.com • e-mail: shares@mangalamcement.com

SBI
Premises Department, 9th Floor, State Bank Bhavan, Corporate Centre, Nariman Point, Mumbai - 400 021.

EXPRESSION OF INTEREST (EOI)
State Bank of India invites Expression of Interest (EOI) for Comprehensive Annual Operation and Maintenance Contract for 10 Nos of Wind Mills of capacity 1500 KW each, installed in the State of Maharashtra, Gujarat and Tamil Nadu. For eligibility criteria and other details please log on to Bank's website www.sbi.co.in <SBI in the NEWS>. Procurement News. Last date for receipt of EOI online Application with supporting documents is 19.03.2021 at <https://tender.sbi/sbi/>. Applications uploaded after due date shall not be entertained. **Corrigendum/Addendum**, if any, in the matter will be published in the above mentioned website. Sd/-
Place: Mumbai | Date: 04/03/2021 Deputy General Manager (Premises)

MOKSH ORNAMENTS LIMITED
CIN: L36996MH2012PLC233562
Regd. Office: B-405/1, B-405/2, 4th floor, 99, Muji Jetha Bldg, Kalbadevi Road, Vitthalwadi, Kalbadevi, Mumbai, Mumbai City MH 400002 IN
Email: jineshwar101@gmail.com | Website: www.mokshornaments.com

CORRIGENDUM
In the voting results of Moksh Ornaments Limited which was published on 03rd March, 2021, where the header was wrongly mentioned as "VOTES CASTED AGAINST", whereas it should be read as "TOTAL VOTES CASTED". The error occurred inadvertently is regretted.
Date: 04th March, 2021 For and on behalf of the Board of Directors
Place: Mumbai Moksh Ornaments Limited
Sd/-
MR. AMRIT SHAH
Managing Director
DIN: 05301251

Bank of India
Bank of India, Head Office, ANS Department - Datawarehouse, Star House 2, C-4 'G' Block, 7th Floor, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai 400 051, E-mail: headoffice.datawarehouse@bankofindia.co.in

REQUEST FOR PROPOSAL (RFP) NOTICE
Bank of India invites Request for Proposal (RFP) for Selection of System Integrator for Implementing Next Generation Datawarehouse Solution for Bank of India. Last date for submission of RFP is 24.03.2021 by 3:00 PM.
Details available on Bank's Corporate Website: www.bankofindia.co.in under "Tender" Section.

Bank of India
Head Office, C-4, G Block, Information Technology Department, Star House-II, 8th floor, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai-400051. E-mail: Headoffice.it@bankofindia.co.in

TENDER NOTICE
REQUEST FOR PROPOSAL (RFP) FOR PROCUREMENT AND IMPLEMENTATION OF TRADE FINANCE SOLUTION
Details available on the Bank's Corporate Website www.bankofindia.co.in under "Tender" section from 03/03/2021. Last Date of Submission 22/03/2021 (till 3.00 pm).

Edelweiss | MUTUAL FUND
Ideas create, values protect

Edelweiss House, Off C.S.T Road, Kalina, Mumbai - 400 098

NOTICE CUM ADDENDUM TO THE STATEMENT OF ADDITIONAL INFORMATION (SAI) OF THE SCHEMES OF EDELWEISS MUTUAL FUND

Appointment of Director on the Board Edelweiss Trusteeship Company Limited

Notice is hereby given that Mr. K. Ramaswamy has been appointed as an Independent Director on the Board of Edelweiss Trusteeship Company Limited with effect from March 3, 2021. Details of Mr. K. Ramaswamy are as follows:

Name of Director	Age	Qualifications	Brief Experience
Mr. K. Ramaswamy	64 Years	BSc, CAIIB and CFA	Mr. K. Ramaswamy has associated with IDBI Bank Limited from 1983 till 2016 and brings in immense value to the Board of ETCL basis his vast experience in the financial services sector. He has rich experience in various departments like, Rehabilitation Finance Department, Project Finance Department, Merchant Banking Department. Most prominently he has also been part of the special teams responsible for setting up of North Eastern Financial Corporation and for identifying issues and solutions related to merger of IDBI-DFI with IDBI Bank.

Pursuant to the above, necessary changes will be carried out in the relevant sections of the SAI of the Schemes of the Edelweiss Mutual Fund ("the Fund"). All the other provisions and terms and conditions of the Schemes of the Fund shall remain unchanged.

This addendum shall form an integral part of the SAI of the Schemes of the Fund, as amended from time to time.

Investors are requested to take note of the above.

For Edelweiss Asset Management Limited
(Investment Manager to Edelweiss Mutual Fund)

Sd/-
Radhika Gupta
Managing Director & CEO
(DIN: 02657595)

For more information please contact:
Edelweiss Asset Management Limited (Investment Manager to Edelweiss Mutual Fund)
CIN: U65991MH2007PLC173409

Registered & Corporate Office: Edelweiss House, Off C.S.T Road, Kalina, Mumbai - 400098; Tel No: 022 4093 3400 / 4097 9821
Toll Free No. 1800 425 0090 (MTNL/BSNL), Non Toll Free No. 91 40 23001181, Fax: 022 4093 3401 / 4093 3402 / 4093 3403
Website: www.edelweissmf.com

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS,
READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

